

Ref: MIL/BSE/2020 Date: 07.09.2020

The Corporate Relations department **Bombay Stock Exchange Limited** Department of Corporate Services P J Towers, Dalal Street, Fort, MUMBAI 400001

Re: Maximus International Limited

Script Code: 540401

Submission of publication of advertisement regarding 5th Annual General Meeting Sub:

in the newspapers.

Intimation under Regulation 47 & 30 and all other applicable regulations, if any, of Ref:

the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as

amended from time to time.

Dear Sir / Madam,

Pursuant to the Regulation 47(1)(d) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended from time to time, we are submitting herewith the newspapers clippings of Notice of 5th Annual General Meeting and E-voting Information published in Vadodara Samachar (Gujarati language newspaper) at Vadodara on Sunday, 6th September, 2020 and Business Standard, English language newspaper (having Nationwide Circulation) on Monday, 7th September, 2020.

Kindly confirm and take the above information on your records.

Thanking you,

Yours faithfully, For Maximus International Limited

Dharati Shah

Company Secretary

Encl: As above

ના પ્રવાસે જવાના ર. અમરેલી અને થાય છે. જો કે સમયની માગના કરવામાં આવ્યો જી તરફ હાલમાં ાંક્રમણમાં વધ ને ભોગ બની રહ્યાં

ા પાસેથી પ્રાપ્ત ru, નવનિયક્ત નો પ્રથમ પ્રવાસ

40 नाभनी કોકાણ કરી ણે સીઆઇડી ગરનો સંપર્ક

વડોદરા તા.પ Gensesis 4U નામે છેતરનાર **જૈનના કૌભાંડોનો** તાના રોકાણની ય ઇન્સપેકટર તો. નં. ૯૪૨૬૫ ઇસેલ, સીઆઇડી ર, સાતમો **માળ**, । सेंडटर-१० પર્ક કરવો, તેમ ત્રાંચની યાદીમા<u>ં</u> યું છે.

mited ara, Gujarat,

sure Requirements) 1 of Directors of the o inter alia conside First Quarter ended

t www.briilaxmi.com india.com. d Finance Limited

Mansi Gandh ompany Secretary

Limited

sure Requirements) of Directors of the o inter alia conside First Quarter ended

www.asianpetro.org eindia.com

d Exports Limited Anjali Gurnani ompany Secretary મેક્સીમસ ઈન્ટરનેશનલ લિમિટેડ

പിബുള്ലാപ : L51900GJ2015PLC085474 રજી.કચેરી : ૫૦૪-એ, ઓઝોન, ડૉ.વિક્રમ સારાભાઈ માર્ગ, વડી-વાડી, વકોદરા - ૩૯૦૦૦૩, ગુજરાત, ટેલી. નં.: +૯૧ - ૨૬૫ - ૨૩૪ ૫૩૨૧

ยลิยัต: info@maximusinternational.in; maximus_international@yahoo.com वेजशाध्यः www.maximusinternational.in

પમી વાર્ષિક સામાન્ય સભા ચોજવાની સૂચના અને ઇ-વો**ર્ટીંગની માહિ**તી

આથી સૂચના આપવામાં આવે છે કે: મેક્સીમસ ઈન્ટરનેશનલ લિમેટેડ (દા "કંપની ")ની વાર્ષિક સામાન્ય સભા બુધવાર તા.30મી સપ્ટેલ્બર, ૨૦૨૦ના રોજ સવારના ૧૧:૦૦ વાગે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સામાન્ય પરિપત્ર નં.૨૦/૨૦૨૦, ૧૪/૨૦૨૦, ૧७/૨૦૨૦નું તેમજ ધી સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) ક્રારા બદાર પાડવામાં આવેલા પરિપત્ર(જે હવે પછી જ પરિપત્રો તરીકે ઓળખાશે) કર્માં ક સેબી/એચઓ/સીએફડી/સીએમડી૧/સીઆઇઆર/૨૦૨૦/૭૯ જેના ક્ષારા કંપનીઓને તાળ/ અચળ/ સાઅફડા/ સાઅમડા 1/ સાઆઇઆર/ ૧૦૧૦/ પ્રષ્ટ જેવા હતા કપનાઓન તેમની એજીએમ કોઈ એક નિર્દારીત સ્થળે, શેરદારક સદસ્યોની જાતઉસ્થિત વગર, વીસી/ઓએવીએમથી ચોજવાની મંજુરી આપવામાં આવી છે, તેનું પાલન કરીને વિડીયો કોન્ફરસીંગ (વીસ)/અન્ય ઓડીયો વિઝસુઅલ મીન્સ(ઓએવીએમ)થી યોજવામાં આવી છે. જેમાં તા. ૧૭મી ઓંગસ્ટ, ૧૦૦૦ની એજીએમ યોજવાની સૂચનામાં જણાવેલી કાર્યસૂચી પ્રમાણેની કાર્યવાઠી હાથ ધરવામાં આવશે. કંપનીઝ એક્ટર, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કચોરમના હેતુસર વીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં ભાગ લઈ રહેલા સદસ્ચોની સંખ્યા કોરમ માટે માન્ય ગણાશે.

પરિપત્રીનું પાલન કરીને, એજીએમ ચોજવાની સૂચના અને ૨૦૧૯/૨૦નો વાર્પિક અહૈવાલ, એવા શેરધારકો જેમના ઈ-મેઇલ આઈડી કંપનીમાં/કિપોજીટરી પાર્ટીસીપન્ટસ સાથે નોંધાયેલા છે તેમને ઇલેક્ટ્રોનીકલી મોકલી આપવામાં આવ્યા છે. આ દસ્તાયેજો કંપનીની વેબસાઇટ www.maximusinternational.in, સ્ટોક એક્સચેન્જની એટલે કે બીએસઇ લિમિટેકની વેબસાઈટ www.bseindia.com અને સીડીએસએલની વેબસાઈટ www.evotingindia.com પર ઉપલબ્ધ છે. તા.૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ઈ-મેઇલથી એજીએમની નોટીસ મોકલવાની સૂચના મોકલવાનું કામ પૂરું કરવામાં આવ્યુ છે.

કટ ઓફ કેટ તા.૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ જે શેરધારકો ફિઝીકલ કે કિમદીરીયલાઇઝય સ્વરૂપમાં શેરધરાવે છે, તેવા સદસ્યો, એજીએમ યોજવાના સૂચના પત્રમાં સમાવિષ્ઠ કાર્યસૂચી પરની બાબતો અંગે પોતાનો મત, સેન્ટ્રલ ડિપોજીટરી સર્વિસીસી (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ જે કંપની હારા એજીએમમાં ઇ-વોર્ટીંગની સુવિઘા/રીમોટ ઇ-વોર્ટીંગની સુવિઘા આપવા માટે અને વીસીથી એજીએમ ચોજવા માટે નિયુક્ત કરવામાં આવેલી એજન્સી છે) તેની ઇલેક્ટોનીક વોરીંગ સિસ્ટમની મદદથી આપી શકશે.

ઇલક્લાનાક પાટાગા તરહાના મદદવા આપા શકરા. આથી તમામ શેરધારક સદસ્ચોને જણાવવામાં આવે છે કે: એજીએમ ચોજવાની સૂચનામાં દર્શાવેલી કાર્ચસૂચિ પ્રમાણેની બાબતો એજીએમમાં રિમોટ ઇન્ વોટિંગ અથવા ઈ-વોટિંગથી હાથ ઘરવામાં આવશે.

રિમોટ ઇ-વોટિંગ રવિવાર તા. રહમી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારના હ:00 વાગ્યા થી શરૂ થશે. રિમોટ ઇ-વોરિંગ મંગળવાર તા.૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજના ૫:૦૦ વાગે પૂરું થશે. રિમોટ ઇ-વોરિંગ અથવા એજીએમમાં વોરિંગથી મતદાન કરવાની શેરધારકની પાત્રતા માટેની

કર ઓફ ડેટ તા. ર૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ છે.

તા. રહમી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સાંજના ૫:૦૦ વાગ્યા બાદ રિમોટ ઇ-વોર્ટિંગની વ્યવસ્થા

િષ્ટિય કરી દેવામાં આવશે. એવી કોઈ પણ વ્યક્તિ જે એજીએમ યોજવાની સૂચના પાઠવી દીધાં પ**છી કંપનીના શેર મેં**ળવે **છે** અને કટ ઓફ ડેટ જે તા. ર૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ છે, તે દિવસે કંપનીના શેર ધરાવે છે. તે helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગીન આઈકી અને પાસવર્ક મેળવી શકે છે, જો કે જો આવી વ્યક્તિ સીડીએસએલમાં ઇ-વોરિંગ **માટે અગાઉથી નોંદાચેતી** છે, તો તે પ્રવર્તમાન લોગીન આઇ.ડી. અને પાસવર્ડનો ઉપયોગ કરીને તેમનો મત આપી શકશે.

સદસ્યો એની પણ નોંધ લે કે. અ) તા.રલ્મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સાંજના ૫:૦૦ વાગ્યા બાદ સીડીએસએલ ક્ષાય રિમોટ ઇ-વોરિંગની વ્યવસ્થા નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને એકવાર કરાવ પર મત

આપી દીધા પછી શેરધારક સદસ્યને એ બદલવાની છૂટ નિંદ મળે.

બ) એજીએમમાં પણ ઈ-વોરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને એજીએમમાં વીસી થી ભાગ લઇ રહેલા શેરધારક સદસ્થો પૈકી જેમણે કરાવો પર મતદાન રિમોટ ઈ-વોટિંગથી કરી લીધું નથી અને જેઓ અન્ય કોઈ રીતે મતદાન કરવા **માટે અન્નોગ્ય નથી**, તેઓ એજીએમમાં રાખવામાં આવેલી ઇ-વોર્ટિંગ સુવિદ્યા ક્ષારા તેમનો મત આપી શકશે.

એવા શેરધારક સદસ્યો જેમણે એજીએમ યોજાય તે પહેલાં જ રિમોટ ઇ-વોર્ટિંગ સુવિધા હેઠળ દરાવો પર મતદાન કરી લીધું છે, તેઓ એજીએમમાં ભાગ લઈ શકરો પરંતુ તેમાં

કરીથી મતદાન નહિ કરી શકે.

કટ ઓફ કેટની તારીએ જેમના નામ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા રજીસ્ટર એફ બેનીફિશિયલ ઓનર્સ જે કિપોઝિટરી કારા નિભાવવામાં આવે છે, તેમાં નીંધાયેલા કરો, માત્ર તેવા શેરધારક સદસ્યો જ રિમોટ ઇ-વોર્ટિંગ અથવા એજીએમમાં ઈ-વોર્ટિંગની

સુવિધાનો ઉપયોગ કરવા માટે અધિકૃત ગણાશે. ૮. એજીએમની સૂચનામાં જે સદસ્થો ડિમેટ સ્વરૂપે કંપનીના શેર ઘરાવે છે અને એવા સદસ્યો જેમણે પોતાનું ઈ-મેલ સરનામું નોંઘાવ્યું નથી તેઓ રિમોટ વોર્ટિંગ **કેવી રીતે કરી શકશે તે** જણાવવામાં આવ્યું છે. આ વિગતો કંપનીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ રહેશે. આવી જાણકારી મેળવવા માટે સદસ્થોને વેબસાઇટ www.maximusintemational.in જોવા વિનંતી છે. જે શેરધારક સદસ્થો એ તેમના ઇમેલ સરનામાની નોંધ નથી કરાવી તેમને સંબંધિત કિપોઝિટરી

પાર્ટીસીપંત્સમાં ને નોંઘવી દેવા વિનંતી છે.

જે સદસ્યોને એજીએમમાં હાજરી આપવા અથવા ઈ-વોર્ટિંગ સિસ્ટમ દ્વારા ઈ-વોર્ટિંગ કરવાની બાબતમાં કોઈ પ્ર*ન કે મુંઝવાણ છે, તેઓ www.evotingindia.com ના **દેલ્પ સેક્સનમાં** ઉપલબ્ધ ઇ-વોરિંગ મેન્યુઅલ અને ફિકવન્ટલી આસ્ક્રડ કવેશ્વનની મદદ લઈ શ**ે છે અથવા**. helpdesk.evoting@cdslindia.com ને ઇમેલ મોકલી શકે છે અથવા શ્રી નીતિન કુંટેર neipdesk.evoiing@cosiiinala.com ન ઇમલ સાકલા શકે છે અવધા ત્રા નાતના ફુઇર (૦૨૨-૨૩૦૫૮७૩૮) અથવા શ્રી મહેબૂબ લાખાટી (૦૨૨-૨૩૦૫૮૫૪૩) અથવા શ્રી સંકેશ દળવી (૦૨૨-૨૩૦૫૮૫૪૨) નો સંપર્ક કરી શકે છે અને ઇલેક્ટ્રોનિક માધ્યમ ક્ષારા ઇ-વોટિંગની સુવિધાની બાબતમાં કોઈ પણ ફરિયાદ અંગે શ્રી રાકેશ દળવી, મેનેજર (સીડીએસએલ) સેન્ટલ ડિપોડિટરી સર્વીસીસ (ઇન્ડિયા) લિમિટેક, એ વિંગ, શ્પમો માળ, (લાંકાઅરાજા) લાંકલા કપાકિસ્થા લાંકાલા (છાંકલા) (લાંકાર, અ (વન, વપક્ષા માળ, કેરેશોન ક્યુરયુરેક્સ, મકતાલાલ શ્રીલ કર્માઉન્ડ, એન.એમ.ગોપી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઇ-૧૦૦૦૧૩ને લાખી શકે છે અથવા helpdesk evoling @cdslindia.com ને ઇમેલ મોકલી શકે છે અથવા જવર-૧૩૦૫૮૫૪૨/૧૩ ને કોલ કરી શકે છે.

भेड्सीमस र्घन्टरनेशनल विभिद्रेड वती

તારીખ : ૦૫.૦૯.૨૦૨૦ 200 : US)E21.

सही/-(श्रद्धी शाव) कंपनी क्षेडेंडरी ब सला योजवानी सूचना कले ई-पोर्टींगनी माहिती

આથી સૂચના આપવામાં આવે છે કે: ઓપ્ટોમસ ફાઇનાન્સ લિમિટેઠ (ધ "કંપની")ની વાર્ષિક સામાન્ય સભા બુધવાર તા.3૦મી સપ્ટેલ્બર, ૨૦૨૦ના રોજ બપોરેના ૦૩:૦૦ વાગે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા બદાર સપ્ટેલ્લર, ૧૦૧૦ના રોજ અપોર્ટના 03:00 વાગે, ક્રોપોરેટ લાબતોના મંત્રાલય કારા લકાર પાડવામાં આવેલા સામાન્ય પરિપત્ર નં.૨૦/૧૦૧૦, ૧૪/૧૦૨૦, ૧૭/૧૦૨૦નું તેમજ દી સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ એફ ઇન્ડિયા(સેલી) ક્ષાય બદાર પાડવામાં આવેલા પરિપત્ર (જે હવે પછી જ પરિપત્રો તરીકે ઓળખાશે) કમાં ક સેલી/એચકી/સીએમકી જેનીઓમાં/રાસ્થિત સ્થળે, શેરધારક સદસ્યોની જાતઉસ્થિત વગર, વીસી/ઓએવીએમ કોઈ એક નિર્ધારિત સ્થળે, શેરધારક સદસ્યોની જાતઉસ્થિત વગર, વીસી/ઓએવીએમથી એજવાની મંજુરી આપવામાં આવી છે, તેનું પાલન કરીને વિડીયો કોન્ફરસીંત્ર (વીસ)/અન્ય એકીયો વિત્રયુઅલ મીન્સ(ઓએવીએમ)થી એજવામાં આવી છે. જેમાં તા.૧૯મો ઓએવીએમ એકી એજવામાં આવી છે. જેમાં તા.૧૯મો ઓએવર, ૨૦૧૦ની એજીએમ યોજવાની સ્થાયામાં જાશાવેલી કાર્યામાં આવી છે. તેને તા.૧૯મો ઓએવર, ૧૦૧૦ની એજીએમ યોજવાની સ્થાયમાં જાશાવેલી કાર્યામાં આવશે. કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ ક્યારમાં સાથા કેતુસર વીસી/ઓએવીએમ કારા એજીએમમાં ભાગ લઈ રહેલા સદસ્યોની સંખ્યા કોરમ માટે માન્ય જાણાવે

કોઝા માટે માન્ય ગણાવો. પરિપત્રોનું પાલન કરીને, એજીએમ મોજવાની સૂચના અને ૨૦૧૯/૨૦નો વાર્પિક અદેવાલ, એવા શેરધારકો જેમના ઈ-નેદલ આદર્લી કંપનીમાં/કિપોજીટરી પાર્ટીસીપન્ટસ સાથે નોંદાચેલા છે તેમને ઇલેક્ટ્રોનીકલી મોકલી આપવામાં આવ્યા છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.optimusfinance.in, २२३८ अंडसचेन्ट्रजी अंटरे हे जीओसर्ग लिभिटेडजी वेजसार्गट www.bsindia.com અને સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com પર ઉપલબ્ધ છે. તા.૦૫ સપ્ટેમ્બર, ૧૦૧૦ના રોજ ઈ-મેઇલથી એજીએમની નોટીસ મોકલવાની

ઉપલબ્ધ છે. તા. ૧૫ સપ્ટેમ્બર, ૧૦૧૦ના રાજ ઇ-મઇલવા અનુઅનના નારાત નારાતા નારાતા કરાયાં. સ્વાના મોકલવાનું કામ પૂર્વ કરવામાં આવ્યું છે. કર એક કેટ તા. ૧૩ની સપ્ટેમ્બર, ૧૦૧૦ના રોજ જે શેરધારકો વિઝીકત કે ઉમરીરીયલાઈફ્ર થ. કર એક કેટ તા. ૧૩ની સપ્ટેમ્બર તેન સરસ્ત્રો, એન્જીએમ ચોજવાના સુચના પત્રમાં સમાવિષ્ઠ કાર્યસૂચી પત્રની બાબતો અંત્રે પોતાનો કાંત, સેન્ટ્રલ કિપોજીટરી સર્વિસીસી (ઈન્ડિસા) લિમિટેડ (સીડીએસએલ જે કંપની નારા એજીએમમાં ઈન્વોર્ટીમની સુવિધા/રીમોટ ઈન્વોર્ટીમની સુવિધા સમેટ અને વીસીથી એજીએમ ચોજવા માટે નિયુકત કરવામાં આવેલી એજન્સી છે) તેની ઇલેક્ટ્રોનીક વોર્ટીંગ સિસ્ટમની મદદથી આપી શકશે.

ઇલેક્ટ્રોનીક વોરીંગ સિસ્ટમની મદદથી આપી શકશે. આવી તમામ શેરધારક સદસ્થોને જણાવવામાં આવે છે કે: એજીએમ મોજવાની સુચનામાં દર્શવિલી કાર્યસૂચિ પ્રમાણોની બાબતો એજીએમમાં રિમોટ ઈ-વોટિંગ અથવા ઇ-વોરિંગરી કાથ દ્રારવામાં આવશે. સ્મિટ ઇ-વોરિંગ સેવાર તા. રહમી સપ્ટેમ્બર, ૧૦૧૦ ના રોજ સવારના ૯:૦૦ વાગ્યા થી શરૂ ઘશે. સ્મિટ ઇ-વોરિંગ સેવાર તા. રહમી સપ્ટેમ્બર, ૧૦૧૦ ના રોજ સાંજના પાંગ વાગે પૂર્વ થશે. સિમોટ ઇ-વોરિંગ એવલા એજીએમમાં લોરિંગથી મતદાન કરવાની શેરધારકની પાત્રતા માટેની

કર ઓફ ડેર તા. ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૭ છે.

તા.રહમી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સાંજના પ:૦૦ વાગ્યા બાદ રિમોટ ઈ-વોર્ટિંગની વ્યવસ્થા

તિષ્ક્રિય કરી દેવામાં આવશે

એવી ક્રોઈ પણ વ્યક્તિ જે એજીએમ યોજવાની સૂચના પાઠવી દીધાં પછી કંપનીના શેર મેળવે છે અને કર ઓફ ડેટ જે તા.ચ.૩મી સપ્ટેમ્બર, ૧૦૧૦ છે, તે દિવસે કંપનીના શેર ઘરાવે છે, તે helpdesk.evoling@cdslindia.com ને વિનંતી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે, જો કે જે આવી લ્યક્તિ સીડીએસએલમાં ઇ-વોરિંગ માટે અગાઉથી નોંધાયેલી છે, તો તે પ્રવર્તમાન લોગીન આઈ.ડી. અને પાસવર્ડનો ઉપયોગ કરીને તેમનો મત આપી શકશે. સદસ્થો એની પણ નોંઘ લે કે.

भ) ता.बहमी सप्टेम्बर, ब०वण्या रोज सोजया ५:०० पाञ्या जाह सीडीએसએल द्वारा स्मिट ई-पोर्टिमनी व्यवस्था निजिय हरी देवामां आवशे अने जेडवार हराव ५१ मत

આપી દીધા પછી શેરધારક સદસ્યને એ બદલવાની છૂટ નહિ મળે.

આપી દીધા પછી શેરધારક સદસ્યને એ બદલવાની ધૂટ નાંઠ મળ. એઝએમમાં પણ ઇ-વોર્ટિંગની સુવિદા ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને એઝએમમાં વીસી થી ભાગ લઈ રહેલા શેરધારક સદસ્યો પૈકી જેમણે કરાવો પર મતદાન રિમોટ ઇ-વોર્ટિંગથી કરી લીધું નથી અને જેઓ અન્ય કોઈ રીતે મતદાન કરવા માટે અચોગ્ય નથી, તેઓ એઝએમમાં રાખવામાં આવેલી ઇ-વોર્ટિંગ સુવિધા કારા તેમનો મત આપી શકશે. એવા શેરધારક સદસ્યો જેમણે એઝએમ ચોગાય તે પહેલાં જ રિમોટ ઇ-વોર્ટિંગ સુવિધા ફેલળ કરાવો પર મતદાન કરી લીધું છે, તેઓ એઝએમમાં ભાગ લઈ શકશે પરંતુ તેમાં

રહિલા કરાવા પર લાદરાના કરા લાધુ છે, તાલા અગ્રાહ્માં માર્ચ છે. કરી શકે. કર ઓફ કેટની તારીએ ચેમના નામ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા રજીસ્ટર ઓફ બેનીફિશિયલ ઓનર્સ જે કિપોઝિટરી હાસ નિભાવવામાં આવે છે, તેમાં નોંધારોલા દશે, માત્ર તેવા શેરધારક સદસ્યો જ સ્મિટ ઇ-વોર્ટિંગ અથવા એજીએમમાં ઇ-વોર્ટિંગની

માત્ર તથા ઘરમારક સદસ્યા જ હિમાટ ઇ-વાદગ અથવા અજીઅમમાં ઇ-વાદગની મુચિલાનો ઉપયોગ કરવા માટે અધિકૃત ગણાશે. એજીએમની સૂચનામાં જે સદસ્યો ક્રિમેટ સ્વરૂપે અથવા ભૌતિક સ્વરૂપે કંપનીના શેર ઘરાવે છે અને એવા સદસ્યો જેમણે પોતાનું ઇ-મેલ સરનામું નોંધાવ્યું નથી તેઓ રિમોટ વોર્ટિંગ કેવી .રીતે કરી શકશે તે જણાવવામાં આવ્યું છે. આ વિગતો કંપનીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. આવી જાણકારી મેળવવા માટે સદસ્યોને વેબસાઇટ www.oplimusfinance.in જોવા

ાવના છે. ક્રિગેટિશઇઝ્ડ મોડમાં શેર ધરાવતા સભ્યો અને જેમના ઇમેઇલ આઇડી નોંધાયેલા નથી, તેઓને ક્રિપોઝિટરી સહભાગીઓ ક્રારા તેમના સંબંધિત કિપોઝિટરીઝ સાથે તેમના ઇમેઇલ સરનામાંઓ અને મોબાઇલ નંબર મોંઘાવવા વિનંતી છે. ભીતિક સ્વરૂપમાં શેર ધરાવતા શેરફોલ્ડરોને તેમની ફ્રોલ્ડિંગ્સ ક્રીમેટ કરવા/કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ મેસર્સ લિક ઇન્ટાઇમ धन्तिया प्राथित विभिरेड साथै vadodara@linkintime.co.in पर तेमना धमेर्धल सरनामांओ અને મોબાઈલ નંબર પ્રદાન કરવા વિનંતી છે.

5 4 of a1 Noa) वशस्प्र https://www.linkintime.co.in/EmailReg/Email_Register.html પર તેમનું ઇ-મેઇલ સરલામું, મોબાઇલ લેવર, પામ અને બેંક વિગતો અપડેટ કરી શકે છે. . જે સદસ્યોને એઝએમમાં કાજરી આપવા અથવા ઇ-વોર્ટિંગ સિસ્ટમ ક્ષારા ઇ-વોર્ટિંગ કરવાની

बाजवाओं डोई प्रन्त हे शुंजवाश है, तेओ www.evolingindia.com ना हेल्प सेडसनमा ઉપલબ્ધ ઈ-વોરિંગ મેન્યુઅલ અને વિકવન્ટલી આસ્કક કવેલનની મદદ લઈ શકે છે અથવા helpdesk.evoling@cdslindia.com ને ઇમેલ મોકલી શકે છે અથવા શ્રી નીતિન કુંદેર helpdesk.evoting@cdslindia.com ને દમેલ મોકલા શકે છે અથવા ત્રાં નાલિલે કુંદર (૦૧૧-૧૩૦૫૮૫૪૩૮) અથવા ત્રી મહેલૂલ લાગાણી (૦૧૧-૧૩૦૫૮૫૪૩) અથવા ત્રી સહેલ દળવી (૦૧૧-૧૩૦૫૮૫૪૩) અથવા ત્રી સહેલ દળવી (૦૧૧-૧૩૦૫૮૫૪૧) નો સંપર્ક કરી શકે છે અને ઇલેક્ટ્રોનેક માધ્યમ હારા ઇન્ટ્રોનો સુવિધાની બાબતમાં કોઇ પણ કરિયાદ અંગે ત્રી રાકેશ દળવી, મેનેજર (સીડોએસએલ) સેન્ટ્રેલ કિપોડિસ્ટરી સર્વીસીસ (ઇન્ટ્રિસા) લિમેટેક, એ વિંગ, ૨૫મો માળ, સેરેશેન ક્યુરતુરેક્સ, મહતલાલ મીલ કચ્ચાઉનક, એન.એમ. જેવી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંલઈ-૧૦૦૧૩ને લખી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com ને ઇમેલ મોકલી શકે છે અથવા ૦૧૧-૧૩૦૫૯૫૧૨/૪૩ ને કોલ કરી શકે છે. અથવા ૦૧૧-૧૩૦૫૯૫૧૨/૪૩ ને કોલ કરી શકે છે.

औरीमस इहिनाल्स लिमिटेड पती

अधी/-(हिमड शवत)

200.00.00 : poly m : asless.

(शेल दार्वभ आयरेक्टर काले कंपनी सेहेटरी)

Business Standard AHMEDABAD | MONDAY, 7 SEPTEMBER 2020

Business standard 07/01/2020, MAXIMUS INTERNATIONAL LIMITED

CIN - L51900GJ2015PLC085474

Regd. Office: 504A, OZONE, Dr. Vikram Sarabhai Marg, Vadi-Wadi, Vadodara - 390003, Gujarat. Tel No: +91 - 265 - 234 5321,

Email: info@maximusinternational.in; maximus_international@yahoo.com Website: www.maximusinternational.in

NOTICE OF THE 5TH ANNUAL GENERAL MEETING AND E-**VOTING INFORMATION**

Notice is hereby given that:

The 5th Annual General Meeting (AGM) of the members of Maximus International Limited (the 'Company') will be held on Wednesday, 30th September, 2020 at 11.00 A.M. through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) in compliance with General Circular numbers 20/2020, 14/2020, 17/2020 issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as 'Circulars') vide which, Companies are allowed to hold AGMs through VC/OAVM, without the physical presence of members at a common venue. Hence, the AGM of the Company is being held through VC/OAVM to transact the business as set forth in the Notice of the AGM dated 17th August, 2020. The Members participating the AGM through VC/OAVM shall be reckoned for the purpose of the quorum under Section 103 of the Companies Act, 2013.

In compliance with the Circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2019-20 have been sent to all the members whose email IDs are registered with the Company/Depository Participant(s). These documents are also available on the website of the Company at www.maximusinternational.in, stock exchange website i.e. BSE Limited at www.bseindia.com and also on the website of the CDSL at www.evotingindia.com. The dispatch of Notice of the AGM through emails has been completed on 5th September, 2020.

Members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date 23rd September, 2020 may cast their votes electronically on the business as set forth in the Notice of the AGM through the electronic voting system of Central Depository Services (India) Limited (CDSL) (an agency appointed by the Company for providing the remote e-Voting facility and e-voting facility during the AGM and conduct of AGM through VC).

All the Members are hereby informed that:

The business as set forth in the Notice of the AGM shall be transacted through remote e-voting or e-voting system at the AGM;

- The remote e-voting shall commence on Sunday, 27th September, 2020 at 9.00 a.m;
- The remote e-voting shall end on Tuesday, 29th September, 2020 at 5.00 p.m;
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by evoting system at the AGM shall be Wednesday, 23rd September, 2020;
- Remote e-voting module will be disabled after 5:00 p.m. on 29th September, 2020;
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holds shares as on the cut-off date ie. 23rd September, 2020, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. However, if a person is already registered with CDSL for e-voting then the existing user ID and password can be used for casting their vote;

Members may note that:

- a) The remote e-voting module shall be disabled by CDSL beyond 5:00 p.m. on 29th September, 2020 and once the votes on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;
- b) The facility for voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM.
- c) The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again; and
- d) Only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- viii. The manner of voting remotely for members holding shares in dematerialized mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company. Members are requested to www.maximusinternational.in to obtain such details.

Members who have not registered their email addresses are requested to register their email addresses with respective depository participant(s).

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and evoting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542) and for any grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, (CDSL,) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk evoting@cdslindia.com or call on 022-23058542/43 For Maximus International Limited

Date: 05.09.2020 Place: Vadodara



AMBA ENTERPRISES LIMITED

RIGHT TECHTEX LIMITED

612, V. K. Indl. Estate, 10/14 Pais Street, Byculla (W) Mumbai 400 011 Email: info@rishitechtex.com
Web: www.rishitechtex.com

NOTICE

given that pursuant to Regulation 47 read with Regulation 29 and 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and any amendments thereof a meeting of the Board of Directors of the Company will be held on Monday, September 14, 2020, inter alia, to consider, approve and take on record the unaudited financial results for the quarter ended June 30, 2020 The said notice can be accessed the Company's website at www.rishitechtex.com and also on the website of the Stock Exchange at www.bseindia.com

For RISHI TECHTEX LIMITED Gauri Gangal Company Secretary

Place: Mumbai

Date: September 05, 2020



CELEBRITY FASHIONS LIMITED

NOTICE

NOTICE is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 o SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, that a meeting of the Board of Directors o CELEBRITY FASHIONS LIMITED in scheduled to be held on Saturday, 12 September, 2020 inter alla, to consider and approve the unaudited financial results of the Company for the quarter ended 30° June

Further, this intimation is also available on the website of the Company a www.celebritygroup.com and on the websit of the stock exchanges where the shares of the Company are listed. I. www.nseindia.com and www.bseindia.com For CELEBRITY FASHIONS LIMITE

Date: 05" September, 2020 Place: Chennal

કેનરા બેંક 🕸 Canara Bank

🎆 सिंडिकेट Syndicate GHODDOD ROAD BRANCH, SURAT POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property)

Whereas:
The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 1/02/2020 calling upon the borrower 1/ KISHORBHAI MOHANBHAI PEDHADIA AND 2) MENABEN KISHORBHAI PEDHADIA to repay theamount mentioned in the notice, being Rs. 21,80,322.62/
(Rupees, TWENTY ONE LACS EIGHTY THOUSANDS THREE HUNDREDS TWENTY TWO AND SIXTY TWO PAISA ONLY) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 3RD day of SEPTEMBER of the year 2020.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs. 22,59,340.62/-(Rupees. TWENTY TWO LACS FIFTY NINE THOUSANDS THREE HUNDREDS FORTY AND SIXTY TWO PAISA ONLY) and interest thereon.

The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Plot no 42."EVERVILLA ROW HOUSE" BLOCK NO - 211 (OLD SURVEY NO - 117/1) OF VILLAGE SAYAN TALUKA-OLPAD DIST. SURAT VALUED AT 28,55,000/-Bounded: On the North by: PLOT NO 27, On the South by: SOCIETY ROAD, On the East by: BLOCK NO 210, On the West by: PLOT NO 41.

: 03.09.2020 PLACE : Surat

Authorised Officer CANARA BANK

SWARNSARITA GEMS LIMITED

CIN: L36911MH1992PLC068283

Reg. Add.: 10, Floor-1*, Plot-40/42, Ruby Chambers, Dhanji Street, Zayeri Bazar, Mumbadevi, Mandvi, Mumbai-400003 Tel. no.: 022-40047000 Fax. No.: 022-43590010 Email: info@swarnsarita.com Website: www.swarnsarita.com

28th ANNUAL GENERAL MEETING - ADDITIONAL INFORMATION INTIMATION NOTICE is hereby given that the 28th Annual General Meeting of the Company will be held or

Tuesday, 29th September, 2020 at 11.00 A.M. (IST) through Video Conference ("VC") Other Audio Visual Means (*OAVM*) (herein after referred to as "electronic mode") to transact the business, as set out in the Notice of the Annual General Meeting which will be circulated